

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૩૦/૦૭/૨૦૧૮ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૪૫૩/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૧ કેસ કરી, ૩૩ વ્યક્તિઓને ઝડપી, ૯૯ લીટર દેશી દારૂ, ૨૬ બોટલ ઇંગ્લીશ દારૂ અને ૧ સ્ફટક કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૪ કેસ કરી ૨૨ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૪૯,૨૪૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૪૫૪/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૯૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ મુજબ ૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ધરફોડ:-

સમાચાર યાદી નં.૧૪૫૫/૧૮

કૃષ્ણનગર: દીપકભાઈ મંગલભાઈ પરમાર (રહે. ગિરધરપાર્ક સોસાયટી અંબાલાલ પાર્ક સામે નીકોલ રોડ નવા નરોડ) એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૮/૭/૧૮ રાતના ૧૦/૦૦ થી તા.૨૯/૭/૧૮ કલાક ૫/૩૦ વાગ્યા દરમિયાન પોતાના મકાનના દરવાજાનો નકુચો તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી સોનાની ચુની કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- અને રોકડ રૂપિયા ૨૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૪૫,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી પી.કે.દવેરા ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૧૪૫૬/૧૮

સાબરમતી: અમીતભાઈ ભીખાભાઈ પારેખ (રહે. ગાયત્રીનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ ચાંદખેડા) એ તા.૨૭/૦૭/૧૮ રાતના ૧૧/૩૦ વાગે સાબરમતી જનપથ ત્રણ રસ્તા પાસે પોતાની ઈનોવા કાર નંબર જીજે ૦૧ એ.કે. ૨૫૧૨ કિંમત રૂપિયા ૮૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી તા.૨૮/૭/૧૮ નારોજ થઈ હતી. આ અંગેની ફરીયાદ અમીતભાઈ પારેખે સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ હે.કો.શ્રી અરવિંદભાઈ માનાભાઈ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૪૫૭/૧૮

રખિયાલ: આશાબહેન ડો/ઓ ખીમજીભાઈ મકવાણા (ઉ.વ.૨૨) (રહે. સંત વિનોબા ભાવેનગર ઉત્તમ ડેરી સામે સુખરામનગર) એ અગમ્ય કારણસર તા.૨૯/૭/૧૮ રાતના ૨/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે રખિયાલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી જે.જે.ગઢવી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.